

[Insert name of recipient and address here (optional)]

પ્રિય વાલીઓ અને દેખભાળકર્તાઓ

તમારા બાળકનું ટ્રાંઝિશન લર્નિંગ અને ડેવલપમેન્ટ સ્ટેટમેન્ટ

તમારા બાળકને શાળામાં હકારાત્મક શરૂઆત કરવામાં મદદરૂપ થવા માટે અમે તમારા બાળક માટે ટ્રાંઝિશન લર્નિંગ અને ડેવલપમેન્ટ સ્ટેટમેન્ટ લખીએ છીએ. ટ્રાંઝિશન સ્ટેટમેન્ટ એ તમારા બાળકના શિક્ષણ અને હિત અંગેની માહિતી શેર કરવાનો એક માર્ગ છે. આ માહિતી:

- તમે
- અમારી સેવા
- તમારા બાળકની ભાવિ શાળા
- અને જો તમારું બાળક કોઈ આઉટસાઇડ સ્કૂલ અવર્સ કેર (OSHC) સેવામાં જતું હોય, તો તેમની વચ્ચે શેર કરાય છે.

આ ટ્રાંઝિશન સ્ટેટમેન્ટમાં નીચે મુજબની માહિતી હશે:

- તમારા બાળકની રુચિઓ, કૌશલ્યો અને ક્ષમતાઓ
- તમારા બાળકને સર્વોત્તમ રીતે શીખવામાં મદદ કેવી રીતે કરવી.

આ માહિતી શાળાને તમારા બાળકને શ્રેષ્ઠ રીતે મદદ કરવામાં મદદ કરશે.

અમારી તમારી પાસેથી શી અપેક્ષાઓ છે

આ ટ્રાંઝિશન સ્ટેટમેન્ટમાં વિવિધ વિભાગો છે, જે તમારા બાળકના અર્લી ચાઇલ્ડહૂડ (પ્રારંભિક બાળપણ) અધ્યાપકે, તમારે અને તમારા બાળકે ભરવાના છે. કૃપા કરીને **વિભાગ ૩** પૂર્ણ કરો: **પરિવાર** [અને તમારા બાળકને **વિભાગ ૨: બાળ પૂરવામાં સહાય કરો**] **[insert date here]** સુધી તે અમારી સેવાને પરત કરી દો.

તમારું યોગદાન મહત્ત્વપૂર્ણ છે પણ ફરજિયાત નથી. આ માહિતી તમારા બાળકના પ્રેપ શિક્ષકને (અને તેના OSHC અધ્યાપકને, જો હોય તો) તમારા બાળકને સારી રીતે સમજવામાં અને તેનું શિક્ષણ અને તેના હિત માટે યોજના ઘડવામાં મદદરૂપ થશે.

આના પછી શું

તમારા બાળકના અર્લી ચાઇલ્ડહૂડ અધ્યાપક ટ્રાંઝિશન સ્ટેટમેન્ટના તમામ વિભાગો એકત્ર કરશે અને તેની એક નકલ તમને આપશે. તમારા બાળકની શાળાને એક નકલ નવેમ્બરમાં મળશે. જો તમે 'પરિવાર' અને 'બાળક'ના વિભાગ પૂર્ણ ન કરો, તો પણ બાકીનું પૂર્ણ કરેલ ટ્રાંઝિશન સ્ટેટમેન્ટ તમારા બાળકની શાળાને અને તમારા બાળકની OSHC સેવાને, જો હોય તો, અપાશે.

સંશોધન દર્શાવે છે કે, માહિતી શેર કરવાથી બાળકોનું શાળામાં ટ્રાંઝિશન સફળતાપૂર્વક થવામાં મદદ મળે છે. જો તમે આ ટ્રાંઝિશન સ્ટેટમેન્ટને તમારા બાળકની શાળા સાથે શેર કરવા માગતા ન હોવ, તો **[insert date here]** સુધીમાં કૃપા કરીને તમારા બાળકના અર્લી ચાઇલ્ડહૂડ અધ્યાપક સાથે વાત કરો.

તમારા બાળકની શાળામાં નોંધણી કરાવવી

જો તમે આવતા વર્ષ માટે તમારા બાળકની નોંધણી શાળામાં હજુ ન કરાવેલ હોય, તો તમે તે વહેલી તકે કરાવી લેશો. નોંધણી કરાવવાથી શાળાને તમારા બાળકની વ્યક્તિગત જરૂરિયાતો માટે યોજના ઘડવામાં મદદ થશે.

શિક્ષણ અને તાલીમ વિભાગ પાસે શાળા શરૂ કરવા અંગે ઉપયોગી માહિતી અહીં છે

<https://www.education.vic.gov.au/parents/going-to-school/Pages/choose-enrol-school.aspx>.

વધુ માહિતી

[please select relevant text based on whether you are providing this information electronically or by hard copy]

[Option 1 – direct parents to website – delete whichever option not used]

આ ટ્રાંઝિશન સ્ટેટમેન્ટ પૂરું કરવા માટે અને શાળામાં હકારાત્મક શરૂઆત માટેની વધુ માહિતી મેળવવા કૃપા કરીને જુઓ:

- પરિવારો માટેનું માહિતી પત્રક
- પરિવારોને ટ્રાંઝિશન લર્નિંગ અને ડેવલપમેન્ટ સ્ટેટમેન્ટ પૂર્ણ કરવા મદદરૂપ થવા માટેની માર્ગદર્શિકા.

આ અહીં ઓનલાઇન છે www.education.vic.gov.au/transitiontoschool.

[Option 2 – attach information to letter – delete whichever option not used]

આ ટ્રાંઝિશન સ્ટેટમેન્ટ પૂરું કરવા માટે અને શાળામાં હકારાત્મક શરૂઆત માટેની વધુ માહિતી મેળવવા કૃપા કરીને અટેચમેન્ટ જુઓ:

- પરિવારો માટેનું માહિતી પત્રક
- પરિવારોને ટ્રાંઝિશન લર્નિંગ અને ડેવલપમેન્ટ સ્ટેટમેન્ટ પૂર્ણ કરવા મદદરૂપ થવા માટેની માર્ગદર્શિકા.

જો તમે તમારા બાળકના શાળામાં ટ્રાંઝિશન અંગે ચર્ચા કરવા માગતા હોવ, તો કૃપા કરીને **[insert name of early childhood educator]** સાથે વાત કરો.

આપનો/આપની વિશ્વાસુ

[Name of early childhood educator]

[Day] [Month] [Year]